

15. અન્ય ઉપયોગી માહિતી

- “ગીર” ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓના ભાગરૂપે વિવિધ પ્રસંગો જેવાં કે વન્યપ્રાણી સપ્તાહ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પૃથ્વી દિન, વિશ્વ જલપ્લાવિત દિવસ, ઓઝોન સંરક્ષણ દિવસ જેવા પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ચિત્ર-સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પ્રકૃતિ શિક્ષણ શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વન્યપ્રાણી સપ્તાહ તા. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન દર વર્ષે ઈન્દોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે મુલાકાતીઓને વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રસંગોએ અખબારોમાં જાહેરાત આપી જાહેર જનતા અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવે છે આ ઉપરાંત ઈન્દોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતેના કલરવ સંકુલ ખાતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં પણ અખબારના માધ્યમ દ્વારા જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવે છે.
- ઈન્દોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય પાર્ક, ગાંધીનગર ખાતે તથા હિંગોળગઢ અભયારણ્ય (રાજકોટ) ખાતે યોજવામાં આવતી પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજન બાબતે પણ અખબારના માધ્યમ દ્વારા જાહેરાત આપી વિવિધ શાળાઓને આમંત્રિત કરવામાં આવે છે. આ માટે શાળાઓને વિસ્તૃત માહિતી આપતો પરિપત્ર પણ પાઠવવામાં આવે છે.
- જાહેર જનતા “ગીર” ફાઉન્ડેશનની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત રીતે જાણકારી મેળવે તે સારું બ્રોશર પણ પ્રકાશિત કરેલ છે. તેમજ ઈન્દોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર અને હિંગોળગઢ અભયારણ્યની વિસ્તૃત વિગતો આવરી લેતું બ્રોશર પ્રકાશિત કરેલ છે. આ તમામ બ્રોશર જાહેર જનતાને વિનામૂલ્યે આપવામાં આવે છે.
- નેશનલ ગ્રીન કોર યોજના હેઠળ રાજ્યની 6750 શાળાઓમાં સ્થાપવામાં આવેલ ઈકો ક્લબો દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણની સભાનતા કેળવાય તેની કામગીરી કરવામાં આવે છે.
- “ગીર” ફાઉન્ડેશન દ્વારા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તથા પ્રકૃતિ, પર્યાવરણ, વન્યપ્રાણી અને અન્ય સંબંધિત શિક્ષણ આપવાનો છે. તા.5-6-2003 થી આકાશવાણીના અમદાવાદ-વડોદરા તથા રાજકોટ કેન્દ્ર ઉપરથી દર રવિવારે રાત્રે 8-00 થી 8.30 સુધી – “હરિયાણું ગુજરાત” નામનો રેડિયો પ્રોગ્રામ પ્રસારિત કરવામાં આવે છે.
- સને 1997 થી પર્યાવરણ, સજીવ સૃષ્ટિ, વિવિધ પરિસરો તથા તેના સંરક્ષણ અને ‘ગીર’ ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતું ત્રિમાસિક સામયિક ‘સૃષ્ટિ’ બહાર પાડવામાં આવે છે.
- “ગીર” ફાઉન્ડેશન દ્વારા માહે નવેમ્બર થી ફેબ્રુઆરી માસના ત્રણ રવિવાર દરમિયાન ઈન્દોડા પાર્ક ખાતે પક્ષી દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં પ્રત્યેક બેચમાં ૪૦-૫૦ તાલીમાર્થીઓને પક્ષીની ઓળખ, વર્તણુક, પક્ષી ઓળખવાની કળા વિગેરેથી માહિતગાર કરવામાં આવે છે.